કર અને દશાંશ

કર - રાજ્યના મહેસૂલમાં ફરજિયાત યોગદાન, જે સરકાર દ્વારા કામદારોની આવક અને વ્યવસાયિક નફા પર વસૂલવામાં આવે છે, અથવા અમુક માલ, સેવાઓ અને વ્યવહારોના ખર્ચમાં ઉમેરવામાં આવે છે.

દશાંશ - વાર્ષિક ઉત્પાદન અથવા કમાણીના 10%, જે અગાઉ ચર્ચ અને પાદરીઓના સમર્થન માટે કર તરીકે લેવામાં આવતો હતો.

પેન્ટાટેચ

અને પરાત્પર દેવને ધન્ય હો, જેમણે તારા શત્રુઓને તારા હાથમાં સોંપી દીધા છે. અને તેણે તેને સર્વનો દશમો ભાગ આપ્યો. ઉત્પત્તિ ૧૪:૨૦

અને જમીનનો બધો દશાંશ ભાગ, પછી ભલે તે જમીનના બીજનો હોય કે વૃક્ષના ફળનો, તે યહોવાનો છે. તે યહોવાને માટે પવિત્ર છે. અને જો કોઈ માણસ પોતાના દશાંશમાંથી કંઈ છોડાવવા માંગે, તો તેણે તેના પાંચમા ભાગનો ઉમેરો કરવો. અને ઢોરઢાંખરના કે ટોળાના દશાંશ ભાગ વિષે, પછી ભલે તે લાકડી નીચેથી પસાર થાય, તો દશાંશ ભાગ યહોવાને માટે પવિત્ર થશે. લેવીય 27:30-32

પણ ઇઝરાયલી લોકો યહોવાહને જે દશાંશ ભેટ તરીકે ચઢાવે છે, તેનો દશાંશ મેં લેવીઓને વારસા તરીકે આપ્યો છે. તેથી મેં તેઓને કહ્યું છે કે, ઇઝરાયલી લોકોમાં તેઓને કોઈ વારસો મળશે નહીં. લેવીઓને આ પ્રમાણે કહેજો અને તેઓને કહેજો કે, જ્યારે તમે ઇઝરાયલી લોકો પાસેથી મેં તમને જે દશાંશ ભાગ આપ્યો છે તે તમારા વારસા તરીકે લો, ત્યારે તમારે તેમાંથી યહોવાહને ચઢાવેલું અર્પણ ચઢાવવું, એટલે કે દશાંશનો દશાંશ ભાગ. આ રીતે તમે ઇઝરાયલી લોકો પાસેથી મેળવેલા તમારા બધા દશાંશમાંથી યહોવાહને ચઢાવેલું અર્પણ ચઢાવો; અને તેમાંથી યહોવાહનું ચઢાવેલું અર્પણ તમે યાજક હારુનને આપો. ગણના ૧૮:૨૪,૨૬,૨૮

અને યુદ્ધમાં ગયેલા યોદ્ધાઓ પાસેથી યહોવાને માટે ખંડણી વસૂલ કરો: માણસો, ગાયો, ગધેડા અને ઘેટાં બંનેમાંથી પાંચસોમાંથી એક જીવ. ગણના 31:28

અને યહોવાને ઘેટાંમાંથી છસો પંદરસો ઘેટાંનો કર હતો. અને ગાયો છત્રીસ હજાર હતા; જેમાંથી યહોવાને કર હતો બાવન. અને ગધેડા ત્રીસ હજાર પાંચસો હતા; જેમાંથી યહોવાને કર હતો એકસઠ. અને સોળ હજાર માણસો હતા; જેમાંથી યહોવાને કર હતો બત્રીસ માણસો. અને યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે મૂસાએ યહોવાને ચઢાવેલું કર, એટલે કે યહોવાને ચઢાવેલું અર્પણ, એલાઝાર યાજકને આપ્યું. ગણના ૩૧:૩૭-૪૧

અને ત્યાં તમારે તમારા દહનાર્પણો, તમારા બલિદાન, તમારા દશાંશ ભાગ, તમારા હાથના અર્પણો, તમારી પ્રતિજ્ઞાઓ, તમારા સ્વેચ્છાર્પણો, તમારા ઢોરઢાંખરના અને તમારા ઘેટાંના પ્રથમજનિત પ્રાણીઓ લાવવા. પછી યહોવાહ તમારા ઈશ્વર પોતાના નામને ત્યાં રહેવા માટે જે સ્થાન પસંદ કરશે તે ત્યાં લાવવું; ત્યાં મેં તમને જે કંઈ આજ્ઞા આપી છે તે બધું લાવવું; તમારા દહનાર્પણો, તમારા બલિદાન, તમારા દશાંશ ભાગ, તમારા હાથનું અર્પણ, અને તમારા બધા શ્રેષ્ઠ શપથ જે તમે યહોવાહને માનતા હો. તમારા અનાજનો, તમારા દ્રાક્ષારસનો, તમારા તેલનો, તમારા ઢોરઢાંખરના કે તમારા ઘેટાંના પ્રથમજનિત પ્રાણીઓનો, અથવા તમારી કોઈપણ શપથ, અથવા તમારા સ્વેચ્છાર્પણો, અથવા તમારા હાથનું અર્પણ. તમારા શહેરમાં તમે ખાશો નહિ. પુનર્નિયમ ૧૨:૬,૧૧,૧૭

તમારા ખેતરમાં વાર્ષિક ધોરણે ઉત્પન્ન થતી બધી જ ઉપજનો દશાંશ તમારે ખરેખર આપવો. અને યહોવાહ તમારા ઈશ્વર જે સ્થાન પોતાનું નામ રાખવા માટે પસંદ કરે ત્યાં, તેમની સમક્ષ તમારા અનાજનો, તમારા દ્રાક્ષારસનો, તમારા તેલનો, તમારા ઢોરઢાંખરના અને તમારા ઘેટાંના પ્રથમ જન્મેલાં બચ્ચાંનો દશાંશ ખાવો; જેથી તમે હંમેશા યહોવાહ તમારા ઈશ્વરનો ડર રાખતા શીખો. ત્રણ વર્ષના અંતે તમારે તે જ વર્ષે તમારી ઊપજનો બધો દશાંશ કાઢીને તમારા દરવાજાઓમાં સંગ્રહ કરવો. અને લેવીઓ, (કારણ કે તેમને તમારી સાથે કોઈ ભાગ કે વારસો નથી), અને તમારા દરવાજાની અંદર રહેતા વિદેશીઓ, અનાથ અને વિધવાઓ, આવીને ખાઈને તૃપ્ત થશે; જેથી યહોવાહ તમારા ઈશ્વર તમારા હાથના બધા કામમાં તમને આશીર્વાદ આપે. પુનર્નિયમ ૧૪:૨૨-૨૩,૨૮-૨૯

અને યહોવાહ તમારા ઈશ્વરના આશીર્વાદ પ્રમાણે, તમારા હાથની સ્વેચ્છાએ આપેલી ભેટ લઈને, અઠવાડિયાઓનો પર્વ યહોવાહ તમારા ઈશ્વર માટે ઉજવો. પુનર્નિયમ ૧૬:૧૦

જ્યારે તમે કોઈ નગર સામે લડવા જાઓ, ત્યારે તેને શાંતિનો પોકાર કરો. અને જો તે તમને શાંતિનો જવાબ આપે અને તમારા માટે દરવાજા ખોલે, તો એવું થશે કે તેમાં રહેલા બધા લોકો તમારા દાસ થશે અને તમારી સેવા કરશે. પુનર્નિયમ 20:10-11

જ્યારે તમે ત્રીજા વર્ષે, એટલે કે દશાંશ વર્ષ, તમારી ઉપજનો બધો દશાંશ આપો, અને તે લેવી, પરદેશી, અનાથ અને વિધવાને આપો, જેથી તેઓ તમારા શહેરમાં ખાઈ શકે અને તૃપ્ત થાય; પુનર્નિયમ 26:12

ઇતિહાસ

અને તેઓએ ગેઝેરમાં રહેતા કનાનીઓને કાઢી મૂક્યા નહિ, પણ કનાનીઓ આજ સુધી એફ્રાઇમના લોકો વચ્ચે રહે છે અને તેઓ ગુલામ તરીકે કામ કરે છે. યહોશુઆ ૧૬:૧૦

છતાં જ્યારે ઇઝરાયલીઓ બળવાન થયા, ત્યારે તેમણે કનાનીઓને મજૂરી કરાવવી પડી; પણ તેમને સંપૂર્ણપણે હાંકી કાઢ્યા નહિ. યહોશુઆ ૧૭:૧૩

અને એમ થયું કે, જ્યારે ઇઝરાયલ બળવાન થયું, ત્યારે તેઓએ કનાનીઓને વેતન માટે મૂક્યા, પણ તેમને સંપૂર્ણપણે હાંકી કાઢ્યા નહિ. ઝબુલોને કિટ્રોનના રહેવાસીઓને કે નાહલોલના રહેવાસીઓને હાંકી કાઢ્યા નહિ; પણ કનાનીઓ તેમની વચ્ચે રહેતા હતા, અને તેઓ તેમના દાસ બન્યા. નફતાલીએ બેથશેમેશના રહેવાસીઓને કે બેથઅનાથના રહેવાસીઓને હાંકી કાઢ્યા નહિ; પણ તે દેશના રહેવાસીઓ કનાનીઓમાં રહ્યો; છતાં બેથશેમેશ અને બેથઅનાથના રહેવાસીઓ તેમના દાસ બન્યા. પણ અમોરીઓ હેરેસ પર્વત પર આયાલોનમાં અને શાઆલ્બીમમાં રહેવા માંગતા હતા; છતાં યુસફના ઘરનો હાથ પ્રબળ થયો, જેથી તેઓ દાસ બન્યા. ન્યાયાધીશો 1:28,30,33,35

અદોરામ કર વસૂલાતનો ઉપરી હતો; અને અહીલુદનો પુત્ર યહોશાફાટ ઇતિહાસકાર હતો. 2 શમુએલ 10:24

અહીશાર ઘરનો કારભારી હતો; અને આબ્દાનો પુત્ર અદોનીરામ કર વસૂલાતનો કારભારી હતો. ૧ રાજાઓ ૪:૬

તેમના પછી દેશમાં બાકી રહેલા તેમના બાળકો, જેમનો ઇઝરાયલી લોકો પણ સંપૂર્ણ નાશ કરી શક્યા ન હતા, તેમના પર સુલેમાને ગુલામીનો વેરો નાખ્યો, જે આજ સુધી ચાલુ છે. ૧ રાજાઓ ૯:૨૧

પછી રહાબઆમ રાજાએ અદોરામને મોકલ્યો, જે મજૂરોનો ઉપરી હતો; અને બધા ઇઝરાયલીઓએ તેને પથ્થરોથી માર્યો કે તે મરી ગયો. તેથી રહાબઆમ રાજાએ તેને રથમાં બેસાડીને યરૂશાલેમ ભાગી જવા માટે ઉતાવળ કરી. ૧ રાજાઓ ૧૨:૧૮

અને ફારુન-નખોએ તેને હમાથ દેશના રિબ્લાહમાં કેદ કર્યો, જેથી તે યરૂશાલેમમાં રાજ ન કરે; અને તેણે દેશ પર સો તાલંત ચાંદી અને એક તાલંત સોનાનો કર નાખ્યો. 2 રાજાઓ 23:33

અને યહોયાકીમે ફારુનને ચાંદી અને સોનું આપ્યું; પણ ફારુનના આદેશ મુજબ પૈસા આપવા માટે તેણે જમીન પર કર નાખ્યો; તેણે દેશના દરેક લોકો પાસેથી તેના કર પ્રમાણે ચાંદી અને સોનું વસૂલ્યું, જેથી તે ફારુન-નખોને આપી શકાય. 2 રાજાઓ 23:35

હિત્તીઓ, અમોરીઓ, પરિઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓમાંથી જે લોકો બાકી રહ્યા હતા, જેઓ ઇઝરાયલના ન હતા, પણ તેમના વંશજોમાંથી જે તેમની પાછળ દેશમાં રહી ગયા હતા, જેમનો ઇઝરાયલીઓએ નાશ કર્યો ન હતો, તેઓને સુલેમાને આજ સુધી ખંડણી તરીકે રાખ્યા. ૨ કાળવૃત્તાંત ૮:૭-૮

પછી રહાબઆમ રાજાએ હદોરામને મોકલ્યો, જે મજૂરોનો ઉપરી હતો; અને ઇઝરાયલી લોકોએ તેને પથ્થરો મારીને માર્યો, અને તે મરી ગયો. પણ રહાબઆમ રાજાએ તેને રથમાં બેસાડીને યરૂશાલેમ ભાગી જવા માટે ઉતાવળ કરી. 2 કાળવૃત્તાંત 10:18

યહૂદાની આસપાસના બધા રાજ્યોમાં યહોવાનો ભય છવાઈ ગયો, તેથી તેઓએ યહોશાફાટ સામે યુદ્ધ કર્યું નહિ. કેટલાક પલિસ્તીઓ યહોશાફાટને ભેટો અને ખંડણી રૂપે ચાંદી લાવ્યા; અને અરબો તેને માટે ઘેટાં, સાત હજાર સાતસો ઘેટાં અને સાત હજાર સાતસો બકરા લાવ્યા. યહોશાફાટ ખૂબ જ મહાન બન્યો; અને તેણે યહૂદામાં કિલ્લાઓ અને ભંડાર નગરો બનાવ્યા. 2 કાળવૃત્તાંત 17:10-12

અને આજ્ઞા ફેલાતાં જ, ઇઝરાયલીઓ અનાજ, દ્રાક્ષારસ, તેલ, મધ અને ખેતરની બધી પેદાશનો પ્રથમ પાક પુષ્કળ પ્રમાણમાં લાવ્યા; અને બધી વસ્તુઓનો દશાંશ તેઓ પુષ્કળ પ્રમાણમાં લાવ્યા. અને યહૂદાના શહેરોમાં રહેતા ઇઝરાયલ અને યહૂદાના લોકો માટે, તેઓ પણ બળદ અને ઘેટાંનો દશાંશ અને તેમના દેવ યહોવાને સમર્પિત કરેલી પવિત્ર વસ્તુઓનો દશાંશ લાવ્યા, અને તેમને ઢગલા કરીને મૂક્યા. અને તેઓએ અર્પણો, દશાંશ અને સમર્પિત વસ્તુઓ વિશ્વાસુપણે લાવ્યા: જેના પર લેવી કોનોન્યા અધિકારી હતો, અને તેનો ભાઈ શિમઈ બીજો હતો. 2 કાળવૃત્તાંત 31:5-6,12

રાજા આર્તાહશાસ્તાને મોકલેલા પત્રની નકલ આ છે; તારા સેવકો, નદી પારના માણસો, અને આવા સમયે. રાજાને ખબર હોય કે, જે યહૂદીઓ તારી પાસેથી અમારી પાસે આવ્યા છે તેઓ યરૂશાલેમમાં આવીને બળવાખોર અને ખરાબ શહેરનું બાંધકામ કરી રહ્યા છે, અને તેની દિવાલો બનાવી રહ્યા છે અને પાયા જોડ્યા છે. હવે રાજાને ખબર હોય કે, જો આ શહેર ફરીથી બંધાશે અને દિવાલો ફરીથી ઉભી કરવામાં આવશે, તો તેઓ કર, કર અને જકાત ચૂકવશે નહીં, અને તેથી તમે રાજાઓના મહેસૂલને નુકસાન પહોંચાડશો. એઝરા 4:11-13

તમે અમને જે પત્ર મોકલ્યો હતો તે મારી સમક્ષ સ્પષ્ટ રીતે વાંચી સંભળાવવામાં આવ્યો છે. મેં આદેશ આપ્યો અને તપાસ કરવામાં આવી, તો જાણવા મળ્યું કે પ્રાચીન કાળથી આ નગરે રાજાઓ વિરુદ્ધ બળવો કર્યો છે, અને તેમાં બળવો અને બળવો થયો છે. યરૂશાલેમમાં પણ ઘણા શક્તિશાળી રાજાઓ રહ્યા છે, જેમણે નદી પારના બધા દેશો પર રાજ કર્યું છે; અને તેમને કર, કર અને જકાત ચૂકવવામાં આવતી હતી. હવે તમે આ

માણસોને કામ બંધ કરવાનો આદેશ આપો, અને જ્યાં સુધી મારી પાસેથી બીજો આદેશ ન મળે ત્યાં સુધી આ નગરનું બાંધકામ બંધ ન થાય. એઝરા 4:18-21

વળી, હું ફરમાવું છું કે ઈશ્વરના આ મંદિરના બાંધકામ માટે તમારે આ યહૂદીઓના વડીલો સાથે શું કરવું: રાજાના માલમાંથી, નદી પારના કરમાંથી, આ માણસોને તાત્કાલિક ખર્ચ આપવામાં આવે, જેથી તેઓને કોઈ અવરોધ ન આવે. એઝરા 6:8

અમે તમને ખાતરી આપીએ છીએ કે, યાજકો, લેવીઓ, ગાયકો, દ્વારપાળો, મંદિરના સેવકો કે દેવના આ મંદિરના સેવકોમાંથી કોઈ પણ પર કર, કર કે કર લાદવો કાયદેસર રહેશે નહીં. એઝરા 7:24

કેટલાક લોકો એમ પણ કહેતા હતા કે, "અમે રાજાના કરવેરા માટે અને અમારા ખેતરો અને દ્રાક્ષવાડીઓ માટે પૈસા ઉછીના લીધા છે." નહેમ્યાહ ૫:૪

અને આપણે આપણા કણકનો પહેલો પાક, આપણા અર્પણો, બધા પ્રકારના વૃક્ષોના ફળ, દ્રાક્ષારસ અને તેલ, યાજકો પાસે, આપણા દેવના મંદિરના ઓરડાઓમાં લાવીએ; અને આપણી જમીનનો દશાંશ ભાગ લેવીઓ પાસે લાવીએ, જેથી લેવીઓ આપણા ખેતરના બધા નગરોમાં દશાંશ ભાગ લઈ શકે. અને લેવીઓ દશાંશ ભાગ લે ત્યારે હારુનનો પુત્ર યાજક લેવીઓ સાથે રહેશે; અને લેવીઓ દશાંશ ભાગ આપણા દેવના મંદિરમાં, ભંડારમાં, ઓરડાઓમાં લાવશે. નહેમ્યાહ 10:37-38

અને તે સમયે કેટલાક લોકોને ભંડારો, અર્પણો, પ્રથમફળો અને દશાંશ માટે ઓરડાઓ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેથી તેઓ નગરોના ખેતરોમાંથી યાજકો અને લેવીઓ માટે નિયમના ભાગો ભેગા કરી શકે: કારણ કે યહૂદા યાજકો અને રાહ જોનારા લેવીઓ માટે આનંદ કરતો હતો. નહેમ્યા 12:44

અને તેણે તેના માટે એક મોટો ઓરડો તૈયાર કર્યો હતો, જ્યાં પહેલાં તેઓ ખાદ્યાર્પણો, લોબાન, વાસણો, અનાજ, નવો દ્રાક્ષારસ અને તેલનો દશાંશ ભાગ, જે લેવીઓ, ગાયકો અને દ્વારપાલોને આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો; અને યાજકોના અર્પણો મૂકતા હતા. પછી બધા યહૂદાના લોકો અનાજ, નવો દ્રાક્ષારસ અને તેલનો દશાંશ ભાગ ભંડારોમાં લાવ્યા. નહેમ્યા ૧૩:૫,૧૨

અને રાજા અહાશ્વેરોશે દેશ અને સમુદ્રના ટાપુઓ પર કર નાખ્યો. એસ્તેર ૧૦:૧

પયગંબરો

પછી તેના રાજ્યના મહિમામાં કર ઉભો કરનાર તેના સ્થાને ઊભો થશે: પણ થોડા દિવસોમાં તેનો નાશ થશે, ન તો ક્રોધમાં, ન તો યુદ્ધમાં. દાનિયેલ ૧૧:૨૦

બેથેલમાં આવો અને પાપ કરો; ગિલ્ગાલમાં પાપ વધારો; અને દરરોજ સવારે તમારા બલિદાન લાવો, અને ત્રણ વર્ષ પછી તમારા દશાંશ: અને ખમીર સાથે આભારસ્તુતિનું બલિદાન ચઢાવો, અને મફત અર્પણોનો પ્રચાર કરો અને જાહેર કરો: કારણ કે હે ઇઝરાયલના લોકો, આ તમારા જેવું છે, પ્રભુ યહોવા કહે છે. આમોસ 4:4-5

શું કોઈ માણસ દેવને લૂંટશે? છતાં તમે મને લૂંટ્યો છે. પણ તમે કહો છો, "અમે તમને ક્યાં લૂંટ્યા?" દશાંશ અને અર્પણોમાં. તમે શાપથી શાપિત છો: કારણ કે તમે મને, આ આખી પ્રજાને પણ લૂંટી લીધી છે. મારા

ઘરમાં માંસ હોય તે માટે બધા દશાંશ ભંડારમાં લાવો, અને હવે આ રીતે મારી કસોટી કરો, "સૈન્યોના યહોવા કહે છે," જો હું તમારા માટે સ્વર્ગની બારીઓ ખોલીને તમારા પર એવો આશીર્વાદ રેડીશ કે તે લેવા માટે પૂરતી જગ્યા નહીં રહે. અને હું તમારા માટે ભક્ષકને ઠપકો આપીશ, અને તે તમારી જમીનના ફળનો નાશ કરશે નહીં; અને તમારા દ્રાક્ષાવેલાને ખેતરમાં સમય પહેલાં ફળ નહીં પડે, "સૈન્યોના યહોવા કહે છે. અને બધી પ્રજાઓ તમને ધન્ય કહેશે: કારણ કે તમે એક આનંદદાયક ભૂમિ થશો," સૈન્યોના યહોવા કહે છે. માલાખી 3:8-12

ગોસ્પેલ્સ

અને જ્યારે તેઓ કાપરનાહુમ આવ્યા, ત્યારે કર વસૂલનારાઓએ પીટર પાસે આવીને કહ્યું, "શું તમારા ગુરુ કર આપતા નથી?" તેણે કહ્યું, "હા." અને જ્યારે તે ઘરમાં આવ્યો, ત્યારે ઈસુએ તેને અટકાવીને કહ્યું, " સિમોન, તને શું લાગે છે? પૃથ્વીના રાજાઓ કોના પાસેથી કર કે કર લે છે? પોતાના બાળકો પાસેથી કે અજાણ્યાઓ પાસેથી?" પીટરે તેને કહ્યું, "અજાણ્યાઓ પાસેથી." ઈસુએ તેને કહ્યું, " તો પછી બાળકો મુક્ત છે. તેમ છતાં, આપણે તેમને ઠોકર ન ખવડાવીએ, તું સમુદ્રમાં જા, હૂક નાખ, અને જે માછલી પહેલી આવે છે તે લઈ જા; અને જ્યારે તું તેનું મોં ખોલીશ, ત્યારે તને પૈસાનો એક ટુકડો મળશે. તે લે અને મારા અને તારા માટે તેમને આપ." માથ્થી ૧૭:૨૪-૨૭

પછી ફરોશીઓએ જઈને તેને કેવી રીતે વાતોમાં ફસાવવા તે અંગે મસલત કરી. અને તેઓએ હેરોદીઓ સાથે પોતાના શિષ્યોને તેમની પાસે મોકલ્યા, અને કહ્યું, "ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે સત્ય છો, અને સત્યથી ઈશ્વરનો માર્ગ શીખવો છો, અને તમે કોઈની પરવા કરતા નથી; કારણ કે તમે માણસોના ચહેરા પર ધ્યાન આપતા નથી. તેથી અમને કહો, તમને શું લાગે છે? કૈસરને કર આપવો ઉચિત છે કે નહીં?" પણ ઈસુએ તેઓની દુષ્ટતા જાણીને કહ્યું, "ઓ ઢોંગીઓ, તમે મને કેમ લલચાવો છો? મને કરના પૈસા બતાવો." અને તેઓ તેની પાસે એક પૈસો લાવ્યા. અને તેણે તેઓને કહ્યું, " આ છબી અને લખાણ કોનું છે?" તેઓએ તેને કહ્યું, "કૈસરનું." પછી તેમણે તેઓને કહ્યું, " તેથી જે કૈસરનું છે તે કૈસરને આપો; અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને આપો." માથ્થી 22:15-21

ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ! કારણ કે તમે ફુદીના, વરિયાળી અને જીરુંનો દશમો ભાગ આપો છો, અને નિયમશાસ્ત્રની ભારે બાબતો, એટલે કે ન્યાય, દયા અને વિશ્વાસ, છોડી દીધા છે. તમારે આ કરવા જોઈતા હતા, અને બીજાઓને પણ છોડી દેવા જોઈતા ન હતા. માથ્થી 23:23

અને જ્યારે તેઓ આવ્યા, ત્યારે તેઓએ ઈસુને કહ્યું, "ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે સાચા છો અને કોઈની પરવા કરતા નથી; કારણ કે તમે માણસોના ચહેરા પર ધ્યાન આપતા નથી, પણ સત્યથી ઈશ્વરનો માર્ગ શીખવો છો: શું કૈસરને કર આપવો ઉચિત છે કે નહીં? શું આપણે આપીએ કે ન આપીએ?" પણ તેમણે તેમનો ઢોંગ જાણીને તેઓને કહ્યું, " તમે મને કેમ લલચાવો છો? મને એક પૈસો લાવો, જેથી હું તે જોઈ શકું." અને તેઓ તે લાવ્યા. અને તેમણે તેઓને કહ્યું, " આ મૂર્તિ અને લખાણ કોનું છે?" તેઓએ તેને કહ્યું, "કૈસરનું." ઈસુએ જવાબ આપ્યો, " જે કૈસરનું છે તે કૈસરને આપો, અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને આપો." અને તેઓ તેના પર આશ્ચર્ય પામ્યા. માર્ક ૧૨:૧૪-૧૭

ઈસુ દાનપેટીની સામે બેઠો હતો અને લોકો દાનપેટીમાં પૈસા કેવી રીતે નાખે છે તે જોતો હતો. અને ઘણા ધનવાન લોકો ઘણું બધું નાખતા હતા. પછી એક ગરીબ વિધવા આવી અને બે નાના ટુકડા નાખ્યા, જે એક પૈસા જેટલા હતા. ઈસુએ પોતાના શિષ્યોને બોલાવીને કહ્યું, " હું તમને સત્ય કહું છું કે, આ ગરીબ વિધવાએ દાનપેટીમાં નાખનારા બધા કરતાં વધારે નાખ્યું છે. કારણ કે બધાએ પોતાના પુષ્કળ પ્રમાણમાં નાખ્યું હતું;

પણ તેણે પોતાની તંગી હોવા છતાં પોતાની પાસે જે કંઇ હતું તે બધું, એટલે કે પોતાની બધી જ જીંદગી પણ નાખી દીધી." માર્ક ૧૨:૪૧-૪૪

અને તે દિવસોમાં એવું બન્યું કે, સીઝર ઓગસ્ટસે હુકમ કર્યો કે આખા જગતમાં નામ નોંધવામાં આવે. (અને આ નામ ગણતરી સૌપ્રથમ કુરેનિયસ સીરિયાનો રાજ્યપાલ હતો ત્યારે કરવામાં આવી હતી.) અને બધા જ પોતાના શહેરમાં નામ નોંધવા ગયા. અને યુસફ પણ ગાલીલથી, નાઝરેથ શહેરથી, યહૂદિયામાં, દાઉદના શહેર, જે બેથલેહેમ કહેવાય છે, ગયો; (કારણ કે તે દાઉદના ઘર અને વંશનો હતો:) તેની સગર્ભા પત્ની મરિયમ સાથે નામ નોંધવા માટે ગયો. લુક 2:1-5

પણ ફરોશીઓ, તમને અફસોસ! કારણ કે તમે ફુદીના, રુદ અને બધી જાતના ઔષધિઓનો દશમો ભાગ આપો છો, અને ન્યાય અને દેવના પ્રેમને અવગણો છો: તમારે આ કરવું જોઈતું હતું, અને બીજાને પણ છોડવા ન જોઈતા. લુક ૧૧:૪૨

બે માણસો પ્રાર્થના કરવા મંદિરમાં ગયા; એક ફરોશી અને બીજો કર ઉઘરાવનાર. ફરોશીએ ઊભા રહીને પોતાની જાત સાથે પ્રાર્થના કરી, "હે ભગવાન, હું તમારો આભાર માનું છું કે હું બીજા માણસો જેવો નથી, જુલમી, અન્યાયી, વ્યભિચારી, કે આ કર ઉઘરાવનાર જેવો પણ નથી. હું અઠવાડિયામાં બે વાર ઉપવાસ કરું છું, મારી બધી સંપત્તિનો દશમો ભાગ આપું છું." અને કર ઉઘરાવનાર દૂર ઊભો રહ્યો અને સ્વર્ગ તરફ આંખો ઊંચી કરીને બોલ્યો, પણ પોતાની છાતી પર મારતો બોલ્યો, "હે ભગવાન, મારા પાપી પર દયા કરો." લુક ૧૮:૧૦-૧૩

અને તેઓએ તેને પૂછ્યું, "ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે સાચું કહો છો અને શીખવો છો, અને કોઈનો પક્ષ લેતા નથી, પણ તમે ઈશ્વરનો માર્ગ સત્ય શીખવો છો: શું કૈસરને કર આપવો એ આપણા માટે ઉચિત છે કે નહિ?" પણ તેણે તેઓની ચાલાકી સમજીને તેઓને કહ્યું, " તમે મને કેમ લલચાવો છો? મને એક પૈસો બતાવો. તેના પર કોની છબી અને શિલાલેખ છે?" તેઓએ જવાબ આપ્યો, "કૈસરનું." અને તેણે તેઓને કહ્યું, " તો જે કૈસરનું છે તે કૈસરને આપો, અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને આપો." લુક 20:21-25

અને તેણે ઉપર જોયું અને શ્રીમંતોને પોતાના દાન ભંડારમાં નાખતા જોયા. અને તેણે એક ગરીબ વિધવાને પણ બે સિક્કા નાખતી જોઈ. અને તેણે કહ્યું, " હું તમને સત્ય કહું છું કે, આ ગરીબ વિધવાએ બધા કરતાં વધારે નાખ્યું છે: કારણ કે આ બધાએ પોતાના પુષ્કળ પ્રમાણમાં ઈશ્વરના અર્પણોમાં નાખ્યું છે; પણ તેણે પોતાની ગરીબીમાંથી પોતાની બધી જ આજીવિકા નાખી દીધી છે." લુક 21:1-4

અને તેઓનો આખો સમુદાય ઊભો થયો અને તેને પિલાત પાસે લઈ ગયો. અને તેઓએ તેના પર આરોપ મૂકવાનું શરૂ કર્યું કે, "અમે આ માણસને રાષ્ટ્રને ભમાવતો અને કૈસરને કર આપવાની મનાઈ કરતો અને કહેતો પકડ્યો કે તે પોતે ખ્રિસ્ત રાજા છે." અને પિલાતે તેને પૂછ્યું, "શું તું યહૂદીઓનો રાજા છે?" અને તેણે તેને જવાબ આપ્યો અને કહ્યું, " તું પોતે કહે છે." પછી પિલાતે મુખ્ય યાજકો અને લોકોને કહ્યું, "મને આ માણસમાં કોઈ દોષ દેખાતો નથી." લુક 23:1-4

તેના પછી વસ્તી ગણતરીના સમયમાં ગાલીલનો યહૂદા ઊભો થયો, અને તેણે ઘણા લોકોને પોતાની પાછળ ખેંચી લીધા; તે પણ નાશ પામ્યો; અને તેના બધા અનુયાયીઓ વિખેરાઈ ગયા. પ્રેરિતોનાં કૃત્યો 5:37

પત્રો

કારણ કે આ કારણસર તમે પણ કર આપો: કારણ કે તેઓ દેવના સેવકો છે, અને આ જ કામમાં સતત તત્પર રહે છે. તેથી, તેમના બધા હકને ચૂકવો: જેને કર ચૂકવવાનો છે તેને કર; જેને કર ચૂકવવાનો છે તેને કર; જેને કર ચૂકવવાનો છે તેને કર; જેને ડર છે તેને ડર; જેને માન આપવામાં આવે તેને માન. રોમનો ૧૩:૬-૭

અને ખરેખર, લેવીના પુત્રોમાંથી જેઓ યાજકપદ મેળવે છે, તેઓને નિયમ પ્રમાણે લોકો પાસેથી, એટલે કે પોતાના ભાઈઓ પાસેથી દશાંશ લેવાની આજ્ઞા છે, ભલે તેઓ ઈબ્રાહિમના વંશમાંથી આવે છે: પરંતુ જેનું વંશજ તેમનામાંથી નથી, તેણે ઈબ્રાહિમ પાસેથી દશાંશ મેળવ્યો, અને જેની પાસે વચનો હતા તેને આશીર્વાદ આપ્યો. અને કોઈ પણ વિરોધાભાસ વિના, નાનાને સારામાંથી આશીર્વાદ મળે છે. અને અહીં મૃત્યુ પામેલા માણસો દશાંશ મેળવે છે; પરંતુ ત્યાં તે તેમને પ્રાપ્ત કરે છે, જેના વિશે સાક્ષી આપવામાં આવે છે કે તે જીવે છે. અને જેમ હું કહી શકું છું, લેવી પણ, જે દશાંશ મેળવે છે, તેણે ઈબ્રાહિમમાં દશાંશ આપ્યો. હિબ્રૂ 7:5-9

એપોક્રિફા

અને લોકોએ યોશિયાના પુત્ર યહોઆહાઝને પકડ્યો અને તેના પિતા યોશિયાને બદલે તેને રાજા બનાવ્યો, જ્યારે તે ત્રેવીસ વર્ષનો હતો. અને તેણે યહૂદિયામાં અને યરૂશાલેમમાં ત્રણ મહિના રાજ કર્યું: અને પછી ઇજિપ્તના રાજાએ તેને યરૂશાલેમમાંથી રાજ કરવાથી દૂર કર્યો. અને તેણે દેશ પર સો તાલંત ચાંદી અને એક તાલંત સોનાનો કર નાખ્યો. 1 એસ્ડ્રાસ 1:34-36

અમારા સ્વામી રાજા આર્તક્ષેક્ષ, તમારા સેવકો, વાર્તાકાર રથુમસ, લેખક શેમેલીયસ, અને તેમની બાકીની કાઉન્સિલ, અને સેલોસીરિયા અને ફેનીસમાં રહેતા ન્યાયાધીશોને. હવે પ્રભુ રાજાને ખબર હોવી જોઈએ કે, જે યહૂદીઓ તમારા તરફથી અમારી પાસે આવ્યા છે, તેઓ બળવાખોર અને દુષ્ટ શહેર યરૂશાલેમમાં આવીને બજારો બનાવી રહ્યા છે, તેની દિવાલોનું સમારકામ કરી રહ્યા છે અને મંદિરનો પાયો નાખી રહ્યા છે. હવે જો આ શહેર અને તેની દિવાલો ફરીથી બનાવવામાં આવશે, તો તેઓ ફક્ત ખંડણી આપવાનો ઇનકાર કરશે જ નહીં, પણ રાજાઓ સામે બળવો પણ કરશે. 1 એસ્ડ્રાસ 2:17-19

તેવી જ રીતે જે લોકો સૈનિકો નથી, અને યુદ્ધમાં ભાગ લેતા નથી, પણ ખેતી કરે છે, જ્યારે તેઓ વાવેલા પાકને ફરીથી લણે છે, ત્યારે તેઓ તેને રાજા પાસે લાવે છે, અને એકબીજાને રાજાને ખંડણી ચૂકવવા માટે દબાણ કરે છે. 1 એસ્ડ્રાસ 4:6

વધુમાં, તેણે પોતાના રાજ્યમાંથી યહૂદીઓમાં ગયેલા બધા યહૂદીઓને તેમની સ્વતંત્રતા વિશે લખ્યું, કે કોઈ અધિકારી, કોઈ શાસક, કોઈ લેફ્ટનન્ટ કે ખજાનચી બળજબરીથી તેમના દરવાજામાં પ્રવેશ ન કરે; અને તેઓ જે દેશ ધરાવે છે તે તમામ દેશ કરવેરા વિના મુક્ત રહે; અને એદોમીઓએ યહૂદીઓના ગામડાઓ જે તે સમયે તેમના કબજામાં હતા તે સોંપી દેવા જોઈએ: હા, મંદિરના નિર્માણ માટે વાર્ષિક વીસ તાલંત આપવામાં આવે, જ્યાં સુધી તે બંધાય નહીં; અને દર વર્ષે બીજા દસ તાલંત, દરરોજ વેદી પર દહનાર્પણો જાળવવા માટે, જેમ કે તેમને સત્તર અર્પણ કરવાનો આદેશ હતો: અને જે લોકો બેબીલોનથી શહેર બનાવવા ગયા હતા તેઓને, તેમજ તેમના વંશજોને, અને બધા યાજકોને મુક્ત સ્વતંત્રતા હોવી જોઈએ. 1 એસ્ડ્રાસ 4:49-53

અને ત્યાંના માણસો બળવો અને યુદ્ધ કરવા માટે તૈયાર હતા: અને તે શક્તિશાળી અને ઉગ્ર રાજાઓ જેરુસલેમમાં હતા, જેઓ સેલોસીરિયા અને ફેનીસમાં શાસન કરતા હતા અને કર વસૂલતા હતા. 1 એસ્ડ્રાસ 2:27

મેં તેને ફરીથી સંપૂર્ણ રીતે બાંધવાનો પણ આદેશ આપ્યો છે; અને તેઓ યહૂદીઓના બંદીવાસમાંથી આવેલા લોકોને મદદ કરવા માટે ખંતપૂર્વક રાહ જુએ છે, જ્યાં સુધી યહોવાનું ઘર પૂર્ણ ન થાય: અને સેલોસિયા અને ફેનીસના કરમાંથી આ માણસોને યહોવાના બલિદાન માટે, એટલે કે, રાજ્યપાલ ઝોરોબાબેલને, બળદો, ઘેટાં અને ઘેટાં માટે કાળજીપૂર્વક એક ભાગ આપવામાં આવે; અને અનાજ, મીઠું, દ્રાક્ષારસ અને તેલ પણ, અને તે દર વર્ષે સતત કોઈ પ્રશ્ન વિના, જેમ કે યરૂશાલેમમાં રહેલા યાજકો દરરોજ ખર્ચ કરવા માટે સંકેત આપશે: રાજા અને તેના બાળકો માટે પરાત્પર દેવને અર્પણો કરવામાં આવે, અને તેઓ તેમના જીવન માટે પ્રાર્થના કરી શકે. 1 એસ્ડ્રાસ 6:28-31

હું તમને એ પણ આદેશ આપું છું કે, તમે કોઈ પણ યાજકો, લેવીઓ, પવિત્ર ગાયકો, દ્વારપાળો, મંદિરના સેવકો, કે આ મંદિરમાં કામ કરતા કોઈપણ વ્યક્તિ પાસેથી કોઈ કર કે અન્ય કોઈ કર વસૂલશો નહીં, અને કોઈ પણ વ્યક્તિને તેમના પર કંઈપણ લાદવાનો અધિકાર નથી. 1 એસ્ડ્રાસ 8:22

તમારા બધા દાનોમાં ખુશખુશાલ ચહેરો રાખો, અને તમારા દશાંશ ભાગ આનંદથી અર્પણ કરો. સભાશિક્ષક ૩૫:૯

અને તેણે એક શક્તિશાળી સૈન્ય ભેગું કર્યું અને દેશો, રાષ્ટ્રો અને રાજાઓ પર શાસન કર્યું, જેઓ તેના દાસ બન્યા. ૧ મક્કાબી ૧:૪

અને બે વર્ષ પૂરા થયા પછી, રાજાએ પોતાના મુખ્ય કર ઉઘરાવનારને યહૂદાના શહેરોમાં મોકલ્યો, જે મોટી સંખ્યામાં યરૂશાલેમ આવ્યો, અને તેઓને શાંતિપૂર્ણ વાતો કહી, પણ બધી વાતો કપટી હતી: કારણ કે જ્યારે તેઓએ તેને વિશ્વાસ અપાવ્યો, ત્યારે તે અચાનક શહેર પર તૂટી પડ્યો, અને તેને ખૂબ જ માર્યો, અને ઇઝરાયલના ઘણા લોકોનો નાશ કર્યો. 1 મક્કાબી 1:29-30

તેમ છતાં, જ્યારે તેણે જોયું કે તેના ખજાનાના પૈસા ખતમ થઈ ગયા છે અને દેશમાં કર ઓછો થઈ ગયો છે, કારણ કે તેણે જૂના સમયના કાયદાઓને રદ કરીને દેશ પર લાવેલા વિવાદ અને રોગચાળાને કારણે, તેને ડર લાગ્યો કે તે હવે ખર્ચ સહન કરી શકશે નહીં, અને પહેલાની જેમ ઉદારતાથી આપવા માટે આવી ભેટો મેળવી શકશે નહીં: કારણ કે તે તેના પહેલાના રાજાઓ કરતાં વધુ સમૃદ્ધ હતો. તેથી, તેના મનમાં ખૂબ જ મૂંઝવણમાં હોવાથી, તેણે પર્શિયા જવાનો નિર્ણય કર્યો, ત્યાં દેશોના કર લેવા અને ઘણા પૈસા એકઠા કરવા. 1 મક્કાબી 3:29-31

તેઓ યાજકોના વસ્ત્રો, પ્રથમ ફળ અને દશાંશ પણ લાવ્યા: અને નાઝારીઓને ઉશ્કેર્યા, જેમણે પોતાના દિવસો પૂરા કર્યા હતા. ૧ મક્કાબી ૩:૪૯

અને તેઓ મહાન બહાદુરીના માણસો હતા. તેમને તેમના યુદ્ધો અને ગલાતીઓ વચ્ચે કરેલા ઉમદા કાર્યો વિશે પણ કહેવામાં આવ્યું, અને તેઓએ તેમને કેવી રીતે હરાવ્યા, અને તેમને કરવેરામાં લાવ્યા; અને તેમની નીતિ અને ધીરજથી તેઓએ બધી જગ્યા જીતી લીધી, ભલે તે તેમનાથી ખૂબ દૂર હતી; અને પૃથ્વીના છેડાથી તેમની સામે આવેલા રાજાઓ પણ, જ્યાં સુધી તેઓએ તેમને નિરાશ ન કર્યા, અને તેમને મોટો પરાજય ન આપ્યો, જેથી બાકીના લોકો દર વર્ષે તેમને ખંડણી આપતા: અને કેવી રીતે તેઓએ તેને જીવતો પકડ્યો, અને

કરાર કર્યો કે તેણે અને તેના પછી રાજ કરનારાઓએ મોટી ખંડણી ચૂકવવી જોઈએ, અને બંધકો આપવા જોઈએ, અને જેના પર સંમતિ થઈ હતી, 1 મક્કાબી 8:2,4,7

અને હવે હું તમને મુક્ત કરું છું, અને તમારા માટે હું બધા યહૂદીઓને કરવેરા, મીઠાના રિવાજો અને તાજ કરમાંથી મુક્ત કરું છું, અને જે મને ત્રીજા ભાગ અથવા બીજ, અને ઝાડના ફળનો અડધો ભાગ મેળવવા માટે યોગ્ય છે, તે આજથી હું મુક્ત કરું છું, જેથી તેઓ યહૂદિયાની ભૂમિમાંથી, કે સમરિયા અને ગાલીલ દેશમાંથી ઉમેરવામાં આવેલી ત્રણ સરકારોમાંથી, આજથી હંમેશ માટે છીનવાઈ ન જાય. યરૂશાલેમ પણ પવિત્ર અને મુક્ત રહે, તેની સરહદો સાથે, દશાંશ અને કરવેરા બંનેમાંથી. 1 મક્કાબી 10:29-31

વધુમાં, હું યહૂદિયા દેશમાંથી મારા રાજ્યના કોઈપણ ભાગમાં બંદીવાન બનાવીને લઈ જવામાં આવેલા દરેક યહૂદીઓને મુક્તપણે મુક્ત કરું છું, અને હું ઈચ્છું છું કે મારા બધા અધિકારીઓ તેમના પશુધનનો પણ કર માફ કરે. ૧ મક્કાબી ૧૦:૩૩

પછી યોનાથાને રાજાને વિનંતી કરી કે તે યહૂદિયાને, સમરૂન દેશ સહિત, ત્રણ રાજ્યોને પણ કરમુક્ત કરે; અને તેણે તેને ત્રણસો તાલંત આપવાનું વચન આપ્યું. ૧ મક્કાબી ૧૧:૨૮

અને બીજી વસ્તુઓ જે આપણી છે, જેમ કે દશાંશ ભાગ અને આપણા સંબંધિત રિવાજો, તેમજ ખારાના ખાડાઓ અને તાજ કર, જે આપણા પર બાકી છે, અમે તેમની રાહત માટે તે બધામાંથી મુક્તિ આપીએ છીએ. 1 મક્કાબીઓ 11:35

આજ સુધી થયેલી કોઈપણ ભૂલ કે દોષ માટે, અમે તેને માફ કરીએ છીએ, અને તાજ કર પણ, જે તમે અમને આપવાના છો: અને જો યરૂશાલેમમાં બીજી કોઈ કર ચૂકવવામાં આવ્યો હોત, તો તે હવે ચૂકવવામાં આવશે નહીં. 1 મક્કાબીઓ 13:39

તો હવે તમે જે નગરો કબજે કર્યા છે અને જે સ્થળો પર તમે યહૂદિયાની સરહદોની બહાર શાસન કર્યું છે ત્યાંની કરવેરા મને સોંપી દો: અથવા તો મને તેમના બદલામાં પાંચસો તાલંત ચાંદી આપો; અને તમે જે નુકસાન કર્યું છે તેના બદલામાં અને શહેરોની કરવેરા માટે, બીજા પાંચસો તાલંત આપો: જો નહીં, તો અમે આવીને તમારી સામે લડીશું. ૧ મક્કાબીઓ ૧૫:૩૦-૩૧

તેથી નિકાનોરે બંદીવાન યહૂદીઓ પાસેથી એટલા પૈસા કમાવવાનું કામ હાથ ધર્યું, જે બે હજાર પ્રતિભાની ખંડણી ચૂકવવા યોગ્ય હતી, જે રાજાએ રોમનોને ચૂકવવાની હતી. 2 મક્કાબીઓ 8:10

આમ, જેરુસલેમમાં બંદીવાનો દ્વારા રોમનોને તેમની ખંડણી ચૂકવવાનું કામ સંભાળનાર, તેણે વિદેશમાં કહ્યું કે યહૂદીઓ પાસે તેમના માટે લડવા માટે ભગવાન છે, અને તેથી તેઓને નુકસાન થઈ શકે નહીં, કારણ કે તેઓ તેમણે આપેલા કાયદાઓનું પાલન કરે છે. 2 મક્કાબીઓ 8:36

જાશર

અને એલામનો રાજા કદોરલાઓમેર હામના કુટુંબોથી દૂર ગયો, અને તેણે તેમની સાથે યુદ્ધ કર્યું અને તેમને હરાવ્યા, અને તે મેદાનના પાંચ નગરોમાં ગયો અને તેમની સામે યુદ્ધ કર્યું અને તેમને હરાવ્યા, અને તેઓ તેના નિયંત્રણ હેઠળ હતા. અને તેઓએ બાર વર્ષ સુધી તેની સેવા કરી, અને તેઓએ તેને વાર્ષિક કર ચૂકવ્યો. યાશેર ૧૧:૧૦-૧૧

કનાન દેશમાં ઇબ્રામના વસવાટના પાંચમા વર્ષે, સદોમ અને ગમોરાહના લોકોએ અને મેદાનના બધા નગરોએ એલામના રાજા કદોરલાઓમેરની સત્તા સામે બળવો કર્યો; કારણ કે મેદાનના બધા રાજાઓએ બાર વર્ષ સુધી કદોરલાઓમેરની સેવા કરી હતી અને તેને વાર્ષિક કર ચૂકવ્યો હતો, પરંતુ તે દિવસોમાં તેરમા વર્ષે, તેઓએ તેની વિરુદ્ધ બળવો કર્યો. યાશેર ૧૩:૧૧

આપણે જાણીએ છીએ કે રાજાઓનો રિવાજ છે કે તેઓ જીવંત લોકો પાસેથી વાર્ષિક કર વસૂલ કરે છે, પરંતુ તમે ફક્ત આ જ નથી કરો છો, પરંતુ મૃતકો પાસેથી પણ તમે દરરોજ કર વસૂલ કરો છો. અને રાજાએ જવાબ આપ્યો અને રિકાયોનને કહ્યું, "તારું નામ હવે રિકાયોન કહેવાશે નહીં, પરંતુ તારું નામ ફારુન રહેશે, કારણ કે તેં મૃતકો પાસેથી કર વસૂલ્યો હતો; અને તેણે તેનું નામ ફારુન રાખ્યું. અને રિકાયોન ફારુને ચાલાકીથી ઇજિપ્તની સરકાર હડપ કરી લીધી, અને તેણે ઇજિપ્તના બધા રહેવાસીઓ પાસેથી કર વસૂલ્યો." યાશેર 14:19,27,31

અને ઇબ્રામ અને તેના બધા લોકો મિસ્રાઈમ નાળામાંથી ઉઠીને ઇજિપ્ત આવ્યા; અને તેઓ શહેરના દરવાજામાં પ્રવેશ્યા પણ નહોતા ત્યારે રક્ષકોએ તેમને કહ્યું, "તમારી પાસે જે કંઈ છે તેનો દશાંશ રાજાને આપો, અને પછી તમે શહેરમાં આવી શકો છો." અને ઇબ્રામ અને તેની સાથેના લોકોએ તેમ કર્યું. અને ઇબ્રામ અને તેની સાથેના લોકોએ મિસર આવ્યા, અને તેઓ આવ્યા ત્યારે તેઓ સારાય જેમાં છુપાયેલી હતી તે પેટી લાવ્યા અને ઇજિપ્તવાસીઓએ તે પેટી જોઈ. અને રાજાના સેવકો ઇબ્રામ પાસે ગયા અને કહ્યું, "આ પેટીમાં તું શું છે જે અમે જોયું નથી? હવે તું પેટી ખોલ અને તેમાં જે કંઈ છે તેનો દશાંશ રાજાને આપ." યાશેર ૧૫:૮-૧૦

અને યાકૂબના પુત્રોએ તેઓને સમ ખાધા કે તેઓ તેમની સાથે દખલ કરશે નહીં, અને કનાનીઓના બધા રાજાઓએ પણ તેમને સમ ખાધા, અને તે દિવસથી યાકૂબના પુત્રોએ તેમને ગુલામ બનાવ્યા. યાશેર 40:48

આખું મિસર યૂસફના તાબા હેઠળ હતું, અને યૂસફે તેના આસપાસના બધા શત્રુઓ સાથે યુદ્ધ કર્યું, અને તેણે તેમને હરાવ્યા; અને કનાનની સરહદ સુધીનો બધો દેશ અને બધા પલિસ્તીઓ પણ યૂસફના તાબા હેઠળ હતા, અને તેઓ બધા તેના તાબા હેઠળ હતા અને તેઓ યૂસફને વાર્ષિક કર આપતા હતા. અને પલિસ્તીઓના બધા દેશો, કનાન, સિદોન અને યર્દનની પેલે પાર, યૂસફના જીવન દરમ્યાન ભેટો લાવતા હતા, અને આખો દેશ યૂસફના હાથમાં હતો, અને તેઓ તેને વાર્ષિક કરવેરા નિયમ મુજબ લાવતા હતા, કારણ કે યૂસફે તેના આસપાસના બધા શત્રુઓ સામે લડીને તેમને હરાવ્યા હતા, અને આખો દેશ યૂસફના હાથમાં હતો, અને યૂસફ મિસરમાં તેના સિંહાસન પર સુરક્ષિત રીતે બેઠો હતો. યાશેર ૫૮:૮,૧૨

અને એમ થયું કે ચોર્યાસીમા વર્ષે, એટલે કે અદોમના રાજા બદાદના દીકરા હદાદના શાસનના પચાસમું વર્ષ, હદાદે એસાવના બધા દીકરાઓને ભેગા કર્યા, અને તેણે પોતાનું આખું સૈન્ય, લગભગ ચાર લાખ માણસોને તૈયાર કર્યા, અને મોઆબ દેશ તરફ પ્રયાણ કર્યું, અને મોઆબ સાથે યુદ્ધ કરવા અને તેમને પોતાના દાસ બનાવવા ગયો. અને જ્યારે બધા મિદ્યાનીઓ યુદ્ધમાં માર્યા ગયા, અને મોઆબના દીકરાઓ બચી ગયા, ત્યારે હદાદે તે સમયે બધા મોઆબને તેના દાસ બનાવ્યા, અને તેઓ તેના હાથમાં આવી ગયા, અને તેઓએ આદેશ મુજબ વાર્ષિક કર ચૂકવ્યો, અને હદાદ પાછો ફર્યો અને પોતાના દેશમાં પાછો ગયો. યાશેર 62:6,13

તેથી કિકિયાનસ અરામ અને પૂર્વના લોકો સામે લડ્યો, અને તેણે તેમની સામે યુદ્ધ કર્યું અને તેમને હરાવ્યા, અને તેઓ બધા કિકિયાનસ અને તેના લોકો સામે ઘાયલ થયા. અને તેણે તેમાંથી ઘણાને બંદી બનાવી લીધા અને પહેલાની જેમ તેમને તાબે કર્યા, અને તેણે હંમેશની જેમ તેમની પાસેથી કર વસૂલવા માટે તેમની ભૂમિ પર છાવણી નાખી. અને કિકિયાનસ અરામ અને પૂર્વના લોકો સામે યુદ્ધ કર્યું અને તેણે તેમને પહેલાની જેમ

જ વશ કર્યા, અને તેઓએ તેને તેમની સામાન્ય કર આપી, અને તે ગયો અને પોતાની ભૂમિ પર પાછો ફર્યો. યાશેર 72:4-5,11

અને પૂર્વના બધા લોકો પાછા ફર્યા અને પાછા ફર્યા, તેથી મૂસા અને કૂશના લોકોએ તેમનો પીછો કર્યો અને તેમને પરાજીત કર્યા, અને તેમના રિવાજ મુજબ તેમના પર કર નાખ્યો. અને અરામ પણ મૂસા અને કૂશના લોકો દ્વારા પરાજીત થયા, અને તેઓએ તેમનો સામાન્ય કર પણ આપ્યો. યાશેર 73:43,46

અને અબિયાનુસે અદોમમાં અધિકારીઓ મૂક્યા અને અદોમના બધા લોકો અબિયાનુસના ગુલામ અને દાસ બન્યા, અને અબિયાનુસ પોતાના દેશ, ચિત્તીમ પાછો ફર્યો. અને તેના શાસનકાળ દરમિયાન તેણે એક સૈન્ય બહાર કાઢ્યું, અને તેણે જઈને જાવાનના પુત્ર એલિશાના પુત્રો, બ્રિટાનિયા અને કર્નાનિયાના રહેવાસીઓ સામે યુદ્ધ કર્યું, અને તેણે તેમના પર વિજય મેળવ્યો અને તેમને દાસ બનાવ્યા. યાશેર 90:10,29

જ્યુબિલીઝ

અને યાકૂબ આ મહિનાની ચૌદમી તારીખે વહેલી સવારે ઊઠ્યો, અને તેણે તેની સાથે આવેલા બધા માણસો અને પશુઓનો, સોનાનો, દરેક વાસણોનો અને વસ્ત્રોનો દશાંશ આપ્યો, હા, તેણે બધાનો દશાંશ આપ્યો. જ્યુબિલીઝ 32:2

અને તેણે બધા શુદ્ધ પ્રાણીઓનો દશમો ભાગ આપ્યો, અને દહનીયાર્પણ કર્યું, પરંતુ અશુદ્ધ પ્રાણીઓ તેણે પોતાના પુત્ર લેવીને આપ્યા (નહીં), અને તેણે તેને બધા માણસોના આત્માઓ આપ્યા. અને લેવીએ તેના પિતા યાકૂબ સમક્ષ તેના દસ ભાઈઓ કરતાં બેથેલમાં યાજકપદનો કાર્યભાર છોડી દીધો, અને તે ત્યાં યાજક હતો, અને યાકૂબે તેની પ્રતિજ્ઞા લીધી: આમ તેણે ફરીથી દશાંશ ભાગ યહોવાને આપ્યો અને તેને પવિત્ર કર્યો, અને તે તેના માટે પવિત્ર બન્યો. અને આ કારણોસર તે સ્વર્ગીય પાટીઓ પર નિયમ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે દશાંશ ભાગ ફરીથી યહોવા સમક્ષ ખાવા માટે, દર વર્ષે, જ્યાં તેનું નામ રહેવા માટે પસંદ કરવામાં આવ્યું છે, ત્યાં ખાવા માટે, અને આ નિયમ માટે કાયમ માટે દિવસોની કોઈ મર્યાદા નથી. આ વટહુકમ લખવામાં આવ્યો છે કે જ્યાં તે પસંદ કરવામાં આવ્યું છે ત્યાં યહોવા સમક્ષ બીજો દશાંશ ખાવાથી તે વર્ષ-દર વર્ષે પૂર્ણ થઈ શકે છે, અને આ વર્ષથી આવતા વર્ષ સુધી તેમાંથી કંઈ બાકી રહેશે નહીં. જ્યુબિલીઝ 32:8-11

અને બળદો અને ઘેટાંનો બધો દશાંશ ભાગ યહોવાને માટે પવિત્ર ગણાશે, અને તેના યાજકોનો થશે, જે તેઓ દર વર્ષે તેમની સમક્ષ ખાશે; કારણ કે આકાશી પાટીઓ પર દશાંશ ભાગ વિષે આ રીતે નિયમ અને કોતરણી કરવામાં આવી છે. જ્યુબિલીઝ 32:15

અને તેણે તેમના પર વિજય મેળવ્યો, અને તેમના પર કર લાદ્યો કે તેઓએ તેને કર આપવો જોઈએ, તેમની જમીનના પાંચ ફળ, અને તેણે રોબેલ અને તામ્નાટારેસ બનાવ્યા. જ્યુબિલીઝ 34:8

અને યાકૂબે પોતાના પુત્રોને સંદેશો મોકલ્યો કે તેઓ શાંતિ કરે, અને તેઓએ તેમની સાથે શાંતિ કરી, અને તેમના પર ગુલામીનું જુલમ મૂક્યું, જેથી તેઓ યાકૂબ અને તેના પુત્રોને હંમેશા ખંડણી આપતા. અને યાકૂબ મિસર ગયો તે દિવસ સુધી તેઓ તેને ખંડણી આપતા રહ્યા. જ્યુબિલીઝ 38:12-13

બાઇબલના ખોવાયેલા પુસ્તકો

અને એવું બન્યું કે, સમ્રાટ ઓગસ્ટસ તરફથી એક હુકમ બહાર પાડવામાં આવ્યો કે, બધા યહૂદીઓ, જેઓ યહૂદિયાના બેથલેહેમના હતા, તેમના પર કર વસૂલવામાં આવે: અને જોસેફે કહ્યું, હું કાળજી રાખીશ કે મારા બાળકો પર કર વસૂલવામાં આવે: પણ હું આ યુવતીનું શું કરું? તેને મારી પત્ની તરીકે કર વસૂલવામાં મને શરમ આવે છે; અને જો હું તેને મારી પુત્રી તરીકે કર વસૂલ કરું, તો બધા ઇઝરાયલ જાણે છે કે તે મારી પુત્રી નથી. જ્યારે પ્રભુની નિમણૂકનો સમય આવશે, ત્યારે તેને જે સારું લાગે તે કરવા દો. અને તેણે ગધેડા પર કાઠી બાંધી, અને તેને તેના પર બેસાડી, અને જોસેફ અને સિમોન તેની પાછળ ગયા, અને ત્રણ માઇલ દૂર બેથલેહેમ પહોંચ્યા. પ્રોટેવેન્જેલીયન 12:1-5

એલેક્ઝાન્ડરના યુગના ત્રણસો નવમા વર્ષમાં, ઓગસ્ટસે એક હુકમનામું બહાર પાડ્યું કે બધા લોકોએ તેમના પોતાના દેશમાં નામ નોંધાવવા જવું જોઈએ. તેથી, યુસફ ઊભો થયો, અને તેની પત્ની મરિયમ સાથે તે જેરુસલેમ ગયો, અને પછી બેથલેહેમ આવ્યો, જેથી તેના અને તેના પરિવારના સભ્યોને તેના પિતૃઓના શહેરમાં નામ નોંધાવવામાં આવે. ઈસુ ખ્રિસ્તના બાળપણની પ્રથમ સુવાર્તા 1:4-5

ઈડનના ભૂલી ગયેલા પુસ્તકો

એક સમયે જ્યારે આપણા પૂર્વજો કાયદાના યોગ્ય પાલન દ્વારા ખૂબ શાંતિનો આનંદ માણતા હતા, અને ખુશ સ્થિતિમાં હતા, તેથી એશિયાના રાજા સેલ્યુકસ નિકાનોરે મંદિર-સેવા માટે કર મંજૂર કર્યો, અને આપણી રાજનીતિને માન્યતા આપી, તે જ સમયે, કેટલાક માણસોએ, સામાન્ય સંમતિ વિરુદ્ધ દગાબાજી કરીને, અમને ઘણી અને વિવિધ આફતોમાં ફસાવ્યા. 4 મક્કાબીઓ 2:10

હું સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે એક કિલ્લો બનાવવા માંગુ છું, અને હું ઈચ્છું છું કે તમે મારા માટે એક જ્ઞાની, હોશિયાર માણસ મોકલો જે મારા માટે તે બનાવે, અને મારા બધા પ્રશ્નોના જવાબ આપે, અને મને ત્રણ વર્ષ સુધી આશ્શૂરના કર અને જકાત મળે. અહિકારની વાર્તા 4:2

તેઓએ અમને ઉશ્કેર્યા છે અને અમારા પર કાબુ મેળવ્યો છે, અને અમારા દેશના ઘણા લોકો ઇજિપ્ત ભાગી ગયા છે કારણ કે ઇજિપ્તના રાજાએ અમારી પાસેથી જે કર માંગવા મોકલ્યો છે તેનાથી ડરીને. પછી તેણે રાજાને કહ્યું. 'હે મારા સ્વામી, ગુસ્સે ના થાઓ! હું ઇજિપ્ત જઈશ, અને હું ફારુનને જવાબો આપીશ, અને હું આ પત્ર તેને બતાવીશ, અને હું તેને કર વિશે જવાબ આપીશ, અને હું ભાગી ગયેલા બધાને પાછા મોકલીશ; અને હું પરાત્પર દેવની મદદથી અને તમારા રાજ્યના સુખ માટે તમારા શત્રુઓને શરમમાં મૂકીશ. અહિકારની વાર્તા 5:5,7

પણ, હે મારા સ્વામી રાજા! તમે તેમાં ત્રણ વર્ષ સુધી ઇજિપ્તના કરવેરા વિશે જે કહ્યું છે, હવે રાજ્યની સ્થિરતા કડક ન્યાય છે, અને જો તમે જીતશો અને મારા હાથમાં તમને જવાબ આપવામાં કોઈ કુશળતા નથી, તો મારા સ્વામી રાજા તમને તે કર મોકલશે જેનો તમે ઉલ્લેખ કર્યો છે. અહિકારની વાર્તા 5:24

અને જ્યારે ફારુને જોયું કે હૈકારે તેને હરાવી દીધો છે, અને તેના જવાબો તેને પાછા આપ્યા છે, ત્યારે તે તરત જ ઉત્સાહિત થઇ ગયો, અને તેમને ત્રણ વર્ષનો કર વસૂલવાનો અને તે હૈકાર પાસે લાવવાનો આદેશ આપ્યો. પછી રાજાએ તેને પૂછવાનું શરૂ કર્યું કે ફારુન તેના પહેલા આગમનથી લઈને તેની હાજરીથી દૂર ન થાય ત્યાં સુધી તેની સાથે કેવી રીતે રહ્યો, અને તેણે તેના બધા પ્રશ્નોના જવાબ કેવી રીતે આપ્યા, અને તેણે તેની પાસેથી કર, અને કપડાં અને ભેટો કેવી રીતે મેળવી. અને રાજા સન્નારીબ ખૂબ આનંદથી ખુશ થયો, અને

તેણે હૈકારને કહ્યું, 'આ કરમાંથી જે તારે જોઈએ છે તે લે, કારણ કે તે બધું તારા હાથમાં છે.' અહિકારની વાર્તા 6:36,46-47

અને અમે તેમને કોઈ નુકસાન કર્યું નહીં, અને તેઓ અમારા ગુલામ બન્યા, અને અમે તેમની લૂંટ તેમને પાછી આપી. યહૂદાનો કરાર 1:49

પછી તેઓએ અમારી પાસેથી શાંતિની શરતો માંગી; અને અમારા પિતા સાથે સલાહ કરીને, અમે તેમને ખંડણી તરીકે સ્વીકાર્યા. અને તેઓએ અમને પાંચસો કોર્ન ઘઉં, પાંચસો બાથ તેલ, પાંચસો માપ દ્રાક્ષારસ આપ્યો, જ્યાં સુધી દુકાળ પડ્યો નહીં, એટલે કે અમે મિસર ગયા. યહૂદાનો કરાર 2:8-9